


*We must never forget
that we are here
to serve the Supramental
Truth and Light and
to prepare its manifestation
in ourselves and upon
the earth.*

with my blessings




We must never forget that we are here to serve the Supramental Truth and Light and to prepare its manifestation in ourselves and upon the earth.

with my blessings
- The Mother

આપણે કદી પણ ભૂલવું ન જોઈએ કે અતિમનસનાં સત્ય અને પ્રકાશનું કામ કરવા તથા આપણી અંદર અને પૃથ્વી ઉપર એના આવિર્ભાવની તૈયારી કરવા આપણે અહીં છીએ.

મારા આશીર્વાદ સાથે
- શ્રી માતાજી

Mantras of the Mother: 27 July 1954 / 13 Aug 1954
શ્રી માતાજીના મંત્રો: ૨૭ જુલાઈ ૧૯૫૪ / ૧૩ ઓગસ્ટ ૧૯૫૪

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ©0413-2331470
સ્વાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨૦ ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • April 2018
 <https://themothersprosperity.org>



Prosperity

શ્રી માતાજીની
સિદ્ધિ-રિદ્ધિ

2018
APRIL


૧ એપ્રિલ, ૨૦૧૮

— To be a fit Instrument —

— કાર્યક્ષમ કરણ બનવા —

*We are upon earth
to manifest the
Divine's will*

With my blessings



We are upon earth to manifest the Divine's will.

With my blessings
- The Mother

પ્રભુની ઇચ્છાનો આવિર્ભાવ કરવા માટે આપણે પૃથ્વી ઉપર છીએ.

મારા આશીર્વાદ સાથે
- શ્રી માતાજી

Sri Aurobindo: I have never had any hesitation in the use of a spiritual force for all legitimate purposes including the maintenance of health and physical life in myself and in others. ... I put a value on the body first as an instrument, *dharmasaadhan*, or, more fully, as a centre of manifested personality in action, a basis of spiritual life and activity as of all life and activity upon the earth, but also because for me the body as well as the mind and life is a part of the Divine Whole, a form of the Spirit and therefore not to be disregarded or despised as something incurably gross and incapable of spiritual realisation or of spiritual use. Matter itself is secretly a form of the Spirit and has to reveal itself as that, can be made to wake to consciousness and evolve and realise the Spirit, the Divine within it. In my view the body as well as the mind and life has to be spiritualised or, one may say, divinised so as to be a fit instrument and receptacle for the realisation of the Divine.

- Sri Aurobindo

શ્રી અરવિન્દ: મારી આધ્યાત્મિક શક્તિ દરેક યથાર્થ હેતુ માટે વાપરવામાં મેં ક્યારે પણ સંકોચ રાખ્યો નથી, અને એમાં મારી અને અન્યની તંદુરસ્તી તથા શારીરિક સ્થૂલ જીવનની સ્વસ્થતા સચવાઈ રહે એ હેતુ પણ આવી જાય.

હું શરીરનું મૂલ્યાંકન સૌ પ્રથમ એક કરણ, એક ધર્મસાધન તરીકે કરું છું, અથવા શરીરના સંપૂર્ણ અસ્તિત્વને એક પ્રગટ થયેલું સતત ક્રિયાશીલ વ્યક્તિનું કેન્દ્ર ગણું છું, અથવા આધ્યાત્મિક જીવન અને પ્રવૃત્તિ તથા પૃથ્વી ઉપરનાં સમગ્ર જીવન અને સર્વ પ્રવૃત્તિઓ માટેનો મુખ્ય આધાર સમજું છું.

અને સૌ પ્રથમ એટલા માટે પણ, કે મારે માટે શરીર – અને સાથે સાથે મન અને જીવન – એ ભગવાનનો અંશ છે, આત્માનું સ્વરૂપ છે, અને એટલે એમ માની લઈને કે તે કાયમ સ્થૂલ રહેશે, એને માટે કોઈ સાક્ષાત્કાર શક્ય નથી, કે તે કોઈ આધ્યાત્મિક કામમાં આવી શકશે નહિ, એનો તિરસ્કાર કે અવગણના કરાય નહિ.

સ્થૂલ પદાર્થ એ અવ્યક્ત આત્માનું સ્વરૂપ છે અને એણે પોતાની જાતને એ આત્મારૂપે વ્યક્ત કરવાની છે.

સ્થૂલ પદાર્થને ચેતનારૂપમાં જાગૃત કરાવી, એ ચેતનાનો વિકાસ કરાવી, એની અંદર રહેલા આત્માનો, ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકાય છે.

મારી દૃષ્ટિએ શરીરને, અને સાથે મન અને જીવનને પણ, આધ્યાત્મિક બનાવવાનું છે જેથી ભગવાનના સક્ષાત્કાર માટે એ કાર્યક્ષમ બને, સુપાત્ર બની રહે.

- શ્રી અરવિન્દ

These are some of the effects of the descent of higher Consciousness into the most physical. It brings light, consciousness, force, Ananda into the cells and all the physical movements. The body becomes conscious and vigilant and performs the right movements, obeying the higher will or else automatically by the force of the consciousness that has come into it. It becomes more possible to control the functions of the body and set right anything that is wrong, to deal with illness and pain, etc. A greater control comes over the actions of the body and even over happenings to it from outside. ... The body becomes a more effective instrument for work. It becomes possible to minimise fatigue. Peace, happiness, strength, lightness come in the whole physical system.

- Sri Aurobindo

ઊર્ધ્વ ચેતના, એની અવતરણની પ્રક્રિયામાં, સૌથી વધુ સ્થૂલ શરીરમાં આવે છે ત્યારે શરીરના કોષોમાં અને શરીરના દરેક હલનચલનમાં પ્રકાશ, ચેતના, શક્તિ અને પરમ આનંદ લાવે છે.

શરીર જાગૃત અને સતેજ બને છે અને ઊર્ધ્વ શક્તિના સંકલ્પ પ્રમાણે દરેક હલનચલન સાચી રીતે જ કરે છે અથવા જે ચેતના એનામાં ઊતરી આવી છે એની શક્તિથી બધું યાંત્રિક રીતે ચાલવા દે છે.

શરીરનાં કાર્યોને કાબૂમાં રાખવાનાં, જે કાંઈ ખોટું હોય એને સુધારી લેવાનું, માંદગી અને પીડા સંભાળી લેવાનાં, ઈ. – આ વધારે શક્ય બને છે.

શરીરની પોતાની ક્રિયાઓ ઉપર અને બહારથી પણ શરીર ઉપર થતી ક્રિયાઓ – આ બંનેની ઉપર વધુ કાબૂ આવે છે....

કાર્યને માટે શરીર અધિક કાર્યક્ષમ એવું સાધન બને છે. શરીરને ઓછામાં ઓછો શ્રમ પડે એવી કાર્યપદ્ધતિ ગોઠવી શકાય છે. શાંતિ, આનંદ, બળ, હલકાપણું આ સર્વ સમગ્ર શરીરતંત્રમાં સ્થિર થાય છે.

- શ્રી અરવિન્દ